

**August 22, 2020**

**National Stock Exchange of India Limited**  
“Exchange Plaza”  
Bandra – Kurla Complex,  
Bandra (E), Mumbai – 400 051  
**NSE Code: GHCL**

**BSE Limited**  
Corporate Relationship Department,  
1<sup>st</sup> Floor, New Trading Ring, Rotunda Building,  
P.J. Towers,  
Dalal Street, Fort, Mumbai – 400 001  
**BSE Code: 500171**

**Dear Sir / Madam,**

**Sub: Filing of Published copy of Advertisement released under Regulation 40 of SEBI (LODR) Regulations, 2015 for transfer of securities in physical mode.**

Pursuant to requirement of Regulation 40 of the SEBI (LODR) Regulations, 2015 read with SEBI circular no. SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated November 6, 2018, please find enclosed herewith copy of advertisement released in The Hindu - Business Line (English) dated August 21, 2020, The Economics Times (English) - Ahmedabad edition dated August 21, 2020 and The Economics Times (Gujarati) dated August 21, 2020.

You are requested to kindly take note of the same and please also take suitable action for dissemination of this information.

Thanking you

Yours faithfully

**For GHCL Limited**

**Bhwneshwar Mishra**  
**Sr. General Manager & company Secretary**



**WBSDDL**  
CIN : U40109WB2007SGC113473, cecorpment@gmail.com, www.wbsedcl.in

The Chief Engineer, Procurement & Contracts Department, Vidut Bhavan (4<sup>th</sup> Floor), Bidhannagar, Block-DJ, Sector-II, Kolkata-91 invites e-Tender from genuine manufacturers only for manufacture, testing, supply and delivery of the following item:-

Sl. No.	Tender Notice No. & Description of Item	Qty.	Estimated Value (approx.)	Last date of submission of e-Tender
1.	P-16/2020-21/PC-I LT Ring Type Tape wound Current Transformer with CTR: 400/5A	1200 Nos.	Rs. 5.46 Lakh	23.09.2020 (up to 14:00 hrs.)

Tenders are to be submitted online through <https://wbttenders.gov.in>. Further details of the Tender Notice may be had from [www.wbsedcl.in](http://www.wbsedcl.in) and the above-mentioned office (Phone No.: 033-23197561/399).

ICA-T3262(1)/2020

**AIA ENGINEERING LIMITED**  
(CIN : L29259GJ1991PLC015182)

Regd. Office : 115, GVMM Estate, Odhav Road, Odhav, Ahmedabad - 382 410  
Website: [www.aiaengineering.com](http://www.aiaengineering.com); E-mail: [ric@aiaengineering.com](mailto:ric@aiaengineering.com)  
Phone: 079-22901078, Fax: 079-22901077

**NOTICE OF 30TH ANNUAL GENERAL MEETING**

NOTICE is hereby given that 30th Annual General Meeting ("AGM") of the AIA Engineering Limited will be held on Monday, 21st September, 2020 at 10.00 A.M. through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the business as set out in the Notice of AGM, which will be circulated for convening the AGM.

In view of the COVID 19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs, vide its Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 20/2020 dated May 5, 2020 and also Securities and Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 ("Circulars"), have permitted the holding of AGM through VC/OAVM, without physical presence of the Members at a common venue. In compliance with these Circulars and the relevant provisions of the Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Members of the Company will be held through VC/OAVM.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2019-20 will be sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depository Participants. Members may note that the Notice of AGM and Annual Report 2019-20 will also be available on the Company's website at [www.aiaengineering.com](http://www.aiaengineering.com), website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and the AGM Notice will also be available on the website of CDSL (agency for providing the Remote e-voting facility) at [www.evotingindia.com](http://www.evotingindia.com). Members can attend and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM will be provided in the Notice of AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. The manner of remote e-voting and e-voting during the AGM for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the members.

Members, who have not registered their email ids so far, are requested to register their email ids for receiving all communications including Annual Report, Notices, etc. from the Company electronically.

- Members holding shares in electronic/demat form, please register your email address with your depository participants. However, Members may temporarily register the same with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Link Intime India Private Limited at [https://linkintime.co.in/EmailReg/Email\\_Register.html](https://linkintime.co.in/EmailReg/Email_Register.html) OR on their website <https://linkintime.co.in/> in the Investor Services tab by providing details such as Name, DP ID, Client ID, PAN, Mobile Number and e-mail address.
- Members holding shares in physical form and who have not registered their email address may register the same with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Link Intime India Private Limited at [https://linkintime.co.in/EmailReg/Email\\_Register.html](https://linkintime.co.in/EmailReg/Email_Register.html) OR on their website <https://linkintime.co.in/> in Investor Services tab by providing details such as Name, Folio number, Certificate number, PAN, Mobile Number and email address and also upload the image of Share Certificate in PDF or JPEG format (upto 1 MB).

On submission of the above member details, One Time Password (OTP) will be received by the Member which needs to be entered in the link for verification.

The Notice of 30th Annual General Meeting will be sent to the shareholders holding shares as on cut-off date for dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com) under help section. All grievances connected with the facility for voting by electronic means can be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatal Mills Compound, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013 or send an e-mail to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or call on 022-23058738 / 022-23058543 / 022-23058542.

For AIA Engineering Limited,  
Sd/-  
(S. N. Jetheliya)  
Company Secretary

Place: Ahmedabad  
Date: 20<sup>th</sup> August, 2020

SURGICAL COTTON MANUFACTURING PLANT - CAP. 2000 KG PER DAY		MAKE / TECH DETAILS
1	EOT CRANE 5 TON WITH VFD DRIVE	SAFEX ELECTROMECH PRIVA
2	SWASTIK 4 COMPARTMENT LOOSE FIBRE DRYER	SWASTIK TEXTILE ENGINEER
3	TEXFAB MAKE HTHP VERTICAL YARN DYEING MACHINE	TEX FAB ENGINEERS INDIA I
4	CENTRIFUGE HYDRO 250 KG / BATCH, TEXFAB MAKE HTHP VE	
5	LIFTING PLATES WITH CHAIN, TEXFAB MAKE HTHP VERTICAL	
6	FIBRE CARRIER, TEXFAB MAKE HTHP VERTICAL YARN DYEING	
7	HYDRAULIC PRESS (50 TONS) WITH FIBRE FEEDING	
8	MANUAL BALE PRESS-2 NOS/GBR - 1 NO/PUMP - 3 NOS -1SET	PUMP - LUBI MAKE

WEAVING MACHINERY		
1	RAPIER WEAVING MACHINE - WIDTH 3600mm	SMIT MAKES MODEL NO. GS940 S2I
2	HYDRAULIC MOTORISED BEAM TROLLEY - MFG YEAR 2013	DOUBLE BEAM ARRANGEMENT PRAS
3	CLOTH ROLL DOFFING TROLLEY	CRADEL TYPE PRASHANT FERBER N
4	SUCKER MULLER 2	YARN DYEING / SIZING MACHINE, V
5	HARISH STENTER 5 CHAMBER	FABRIC HEAT SETTING MACHINE, V
6	DHALL MERCERISER-3	FABRIC FINISHING MACHINE, WWW: I
7	HACOBA DIRECT WARPING	PRASHANT: DISC TYPE CREEL 624 E
8	RAPIER LOOM	GAMMAX - 4P WIDTH 190 CM 4 CO 1620 B, 6 NO. OF FRAME WITH BAT
9	TSUDAKOMA AIR JET LOOM	ZAX 9100 - 190, WIDTH 190 CM, 2 C TYPE 1661, 6 NO. OF FRAME WITH I
10	TOYOTA AIR JET LOOM	JAT 710 WIDTH 190 CM, 2 COLOUR 6 NO. OF FRAME WITH BATCHING N
11	TOYOTA AIR JET LOOM	EURO TT-190 WIDTH 190 CM 2 COL 6 NO. OF FRAME WITH BATCHING N

Please email your competitive bids before 23rd Aug  
to [team.capex@arvindexports.com](mailto:team.capex@arvindexports.com)

Contact: Mr. Chetan Modi | Mr. Sanj  
Mob: 7600946401 | Mob: 81

**GHCL Limited**  
(CIN : L24100GJ1983PLC006513)  
Regd. Off.: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura,  
Ahmedabad-380009. (Gujarat) Ph. 079-26434100 Fax: 079-26423623  
Email: [ghclinfo@ghcl.co.in](mailto:ghclinfo@ghcl.co.in), [secretarial@ghcl.co.in](mailto:secretarial@ghcl.co.in) Website: [www.ghcl.co.in](http://www.ghcl.co.in)

**NOTICE**

Notice be and is hereby given that the following shareholders have lodged transfer deed(s) along with share certificate(s) for transfer of shares with old transfer deed (Form 7B) as per details given below:

Sr. No.	Name of Transferor	Folio No.	Certificate No.	Distinctive Nos.	No. of Shares	Name of Transferee
1.	Manisha Kumari	0073394	397035	24788216-24788315	100	Dhani Ram Sharma
2.	Manisha Kumari	0073394	397036	24242116-24242215	100	Dhani Ram Sharma

As per SEBI circular dated November 6, 2018, clause 2(c) allows transfer of shares in case of major mismatch/non-availability of transferor's signatures, subject to procedural requirements to be complied. The company will process transfer of the aforesaid shares in case of the company/its Share Transfer Agent (i.e. M/s. Link Intime India Private Limited, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai-400083) do not receive any objections for the same within 30 days from date of publication hereof.

For GHCL Limited  
Sd/-  
Bhawneshwar Mishra  
Sr. General Manager & Company Secretary

Place : Noida  
Date : August 11, 2020

**Sadbhav INFRASTRUCTURE PROJECT LTD.**  
CIN: L45202GJ2007PLC049808  
Regd. Office: Sadbhav House, Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad: 380006  
Tel No. : +91-79-26463384 Fax: +91-7926400210  
E-mail: [investor@sadbhavinfra.co.in](mailto:investor@sadbhavinfra.co.in) Website: [www.sadbhavinfra.co.in](http://www.sadbhavinfra.co.in)

**NOTICE**

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, NOTICE is hereby given that a Meeting of Board of Directors of the Company is scheduled to be held on Monday, 31st day of August, 2020, inter-alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended on 30th June, 2020.

This said information is also available on the Company's website at [www.sadbhavinfra.co.in](http://www.sadbhavinfra.co.in) and may also be available on the website of the Stock exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) & [www.nseindia.com](http://www.nseindia.com).

For, Sadbhav Infrastructure Project Limited  
Hardik Modi  
Company Secretary  
Date : 20/08/2020  
Place : Ahmedabad

We u  
Dem  
1 Sh  
(Part  
Plot  
Sahj  
Way  
3 Nir  
(Part  
& Mo  
170,  
Stre  
Koth  
Notic  
issue  
Regis  
Notic  
Rules  
you it  
29/06  
hereb  
Thre  
Paisa  
costs  
publi  
the st  
provi  
under  
You a  
lease  
Secu  
1. Pri  
and fi  
2. Co  
Prop  
No-8  
Corp  
owne  
North  
Sub-  
Indus  
area  
Estat  
City  
Gujar  
Virjib  
West  
Date  
Place





VEDANTA RAISES \$1.4 B VIA BOND ISSUE
Vedanta Resources has raised \$1.4 billion through senior secured bonds with an annual coupon of 13 per cent for 3 years.

Offshore funds, ETFs pull out \$1.5 b in June quarter on economy worry

These funds on exit mode for the ninth consecutive quarter: Morningstar study

SURESH PIVNENKAR
India-focused offshore funds and ETFs (exchange traded funds) continued to be on exit mode, but slowed their withdrawals to \$1.5 billion in the June quarter against \$5 billion in the March quarter.

However, the recovery in the equity markets during the last quarter helped the asset-based offshore funds and ETFs surge to \$34 billion against \$30 billion logged in the previous quarter.



For businesses around the globe and no idea what the recovery will look like.

Painful Q1 2020
The first quarter of this year was exceptionally painful for the financial markets worldwide. The Indian equity market, too, witnessed intense volatility and declined sharply in the March quarter.

ounded sharply to \$6.49 trillion for the quarter ending June 2020 compared with \$5.22 trillion in the previous quarter. The value of investments into Indian equities by foreign funds rose to about \$19 billion against \$14 billion in the previous quarter.

'Institutional flows may slow'
BoFA Securities sees markets consolidating in the near term

OUR BUREAU
Global quantitative strategy team, BoFA Securities, expects markets to consolidate in the near term.

India's Government's capex push, BoFA Securities adds.
Dilts are already overweight on industrials but could see an increase in allocation towards the materials sector.

UTI Equity Fund to pay ₹3 as dividend
UTI Mutual Fund proposes to pay a dividend of ₹3 a unit in UTI Equity Fund.

₹1 bonus for Aarti Drugs
The board of directors of Aarti Drugs on Thursday approved the issuance of fully paid-up bonus share in the ratio of 1:1 (three bonus shares of ₹10 each for one fully paid-up equity share).

NSFE pitches for a '5C' model to make all Indians financially literate

5-year plan to take into account digital shift, changes in payment infra

OUR BUREAU
The revised National Strategy for Financial Education (NSFE - 2020-25) has recommended adoption of a '5 C' - Content, Capacity, Community, Communication and Collaboration - approach to achieve the financial well-being of all Indians.

actions and payment infrastructure (Goal of Less Cash Economy) and subsequent to the completion of NSFE - 2019-2018.

Sensex, Nifty dip on weak global cues

SENSEX TRUST OF INDIA
The Sensex dropped 394 points while the Nifty closed below the 18,500-level on Thursday in tandem with a global sell-off after the US Federal Reserve's gloomy economic outlook spoke to investors across the world.

Why has True Beacon, which beat Nifty 50 Index, turned cautious now?

BLOOMBERG
The Nifty 50 Index has been performing Indian hedge fund that was bold enough to load up local shares in the depth of the March sell-off is now turning cautious on the country's stock market after a stellar return.

adding shares of software exporters and pharmaceutical companies. Reliance Industries Ltd. is another one that the fund had been adding. It is the so-called FAANG companies, the quintet of Facebook, Apple, Amazon, Netflix and Google.

Most hedge funds in India do not publicly disclose performance, but an index of the nations 14 long-short equity funds compiled by Eureka hedge shows a 13 per cent return this year.

TODAY'S PICK

VRL Logistics (₹168.4): Buy
The stock of VRL Logistics gained 6 per cent on Thursday, breaching a key resistance at ₹160. This rally provides investors with a short-term horizon an opportunity to buy the stock at current levels.

COMMODITY CALL

MCX-Zinc: Go long on declines
MCX Zinc
Return: 8.0%
The stock of MCX Zinc has been in a broad sideways consolidation phase in the wide band between ₹145 and ₹154. Within this range, the stock took support at ₹145 in early August and began to trend upwards.

DAY TRADING GUIDE

Table with columns for stock name, price, and trading strategy. Includes entries for Nifty 50 Futures, HDFC Bank, Infosys, ITC, ONGC, Reliance Ind., and TCS.

NOTICE TO SHAREHOLDERS

Notice to Shareholders regarding AGM and Annual Report for the year 2019-20. Includes details for Western Coalfields Limited and Sandhya Spinning Mill Limited.

Western Coalfields Limited (A subsidiary of Coal India Ltd.)
COMMON WINDOW: All the tenders issued by WCL for Procurement of work items are available on website of Coal India Ltd.

LAMBODHARA TEXTILES LIMITED
Reg. Office: 10, Ashok, Park, Sector-14, Gurgaon, Haryana

GHCL Limited
Reg. Office: Gh. Ch. Road, Ph. Road, Punjab, India
Notice to Shareholders regarding AGM and Annual Report for the year 2019-20.

SANDHYA SPINNING MILL LIMITED
Reg. Office: No. 41, P.S. 8, Nagar, Rajajinagar - 676 106, Tamil Nadu.
Notice of 26th Annual General Meeting





પદ્મવિભૂષણ પંડિત જસરાજનું નાર્ડિઆક એરેસ્ટથી નિધન થતા તે લાવવામાં આવેલા તેમના ને અંતિમ દર્શન માટે રાખવામાં હાલતમાં તેમના પત્ની મધુરાજ તથા પુત્ર સારંગદેવ તેમના હે છે

## વાધવાન અને ધીરજ માંથી મળ્યા જામીન

મની લોન્ડ્રિંગ કેસમાં ઈજ્ઞ દ્વારા આ વર્ષે ૧૪ મે એ ધરપકડ થઈ હતી. સીબીઆઈ દ્વારા ૭ માર્ચે વધાવન બંધુઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં એ આરોપ લગાવ્યો હતો કે યસ બેકના પ્રમોટર રાજા કપૂર અને વધાવન બંધુઓ એ એકબીજાને લાભ પહોંચાડ્યો છે. યસ બેક દ્વારા અનિયમિત રીતે વધાવન બંધુઓને લોન આપી છે.

જે બાદ ઈજ્ઞએ વધાવન બંધુઓ, રાજા કપૂર, કપૂરની પત્ની બિંદુ કપૂર, તેમની દિકરી રોશની અને રેખા તથા તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ ડી કે જૈન એન્ડ એસોસિએટ્સ વિરુદ્ધ ૧૫ જુલાઈએ કેસ નોંધવામાં આવ્યો હતો.



મ. સી.જી.રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, ગુજરાત

કલકત માટે)

મેન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, થી અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ નો અમલ કરતા, અહીં નીચે જણાવેલ કરજદાર(રો)/ મને આ નોટીસમાં જણાવેલી રકમ કથિત નોટીસની રકમ ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, આ દ્વારા રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ ૨૦૦૨ના નિયમ ૮ સાથે અહીં નીચે સહી કરનાર અધિકારીએ, નીચે વર્ણન કર્યા પા સંદર્ભમાં કથિત એક્ટની કલમ ૧૩ની પેટાકલમ પ્રતી જાહેર જનતાને આ મિલકત અંગે કોઈ વ્યવહાર પ્રાપ્ત કરવા અને તેની ઉપરના વ્યાજ સાથેની રકમ

# લઘુતમ વેતનની ટોચ મર્યાદા નક્કી થશે: ફોર્મ્યુલા ઘડવા ઉદ્યોગજગતનું સૂચન

નવી દિલ્હી તા.૨૦ કેન્દ્ર સરકાર લઘુતમ વેતનની ઉપરની મર્યાદા નક્કી કરવા વિચાર કરશે.

ઉદ્યોગ જગતે આ મામલે પોતાના સૂચનો સરકારને આવ્યા છે. એ મુજબ લઘુતમ વેતનની સીમા દરેક રાજ્યમાં ભલે અલગ હોઈ, પણ એની ઉપરની મર્યાદા નક્કી કરવી જોઈએ.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગો ઈચ્છે છે કે લઘુતમ વેતનમાં અમારા માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે અને તેમાં કન્સ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મુજબ વધારો કરવામાં આવે. આપુ થવાથી લઘુતમ વેતન કાયદામાં મજૂરીની મહત્તમ સીમા પણ નક્કી થઈ જશે.

ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને આશંકા છે કે આવી કોઈ ફોર્મ્યુલા વગર લઘુતમ વેતન વધારવાથી તેના પર અચાનક ખોજ વધી જશે. એ જોતાં રાજ્ય

સરકારો તરફથી એક ફોર્મ્યુલા રજૂ કરવામાં આવે તે આવશ્યક છે.

## ઉદ્યોગ જગતે સંમતિ આપી નવેમ્બરથી લઘુતમ વેતનનો નવો કાયદો અમલી બનશે

છે કે સરકાર કર્મચારીઓને પાંચ વર્ષના બદલે એક વર્ષની નોકરી પછી પણ ગ્રેડ્યુઈટી આપવા ઈચ્છતી હોય

તો તેને કોઈ વાંધો નથી.

ઉદ્યોગજગતે છે કે નવેમ્બરથી સમગ્ર દેશમાં લઘુતમ વેતનનો નવો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે સંસદે પસાર કરેલા કોડ ઓન વેલ્થસ બિલને કાનુની સ્વરૂપ આપવા તૈયારી કરી છે.

થ લઘુતમ વેતનના ડ્રાફ્ટ મામલે કોઈને વાંધાસૂચનો હોય તો તે ૨૪ ઓગષ્ટ સુધીમાં રજૂ કરી શકાશે.

**ગુએચસીએલ લિમિટેડ**  
(CIN : L24100GJ1983PLC006513)  
રજી. ઓફીસ : ગુએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮, (ગુજરાત) Ph. 079-26434100 Fax: 079-26423623  
Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in Website: www.ghcl.co.in

**નોટીસ**

આથી નોટીસ આપીને જણાવવાનું કે નીચેના શેરદારો દ્વારા જૂના ટ્રાન્સફર દસ્તાવેજની સામે (શોર્ટ જબી) તેમના શેરોને ટ્રાન્સફર કરવા શેર સર્ટિફિકેટ સહીતના ટ્રાન્સફર દસ્તાવેજોને રજૂ કરેલ છે જેની વિગતો નીચે મુજબ છે.

નં.	ટ્રાન્સફર નું નામ	ફોલીઓ નંબર	સર્ટિફિકેટ નંબર	ફિરદાઈકર નંબર	શેરોની સંખ્યા	ટ્રાન્સફર નું નામ
1.	મનિષા કુમારી	0073394	397035	24788216-24788315	100	ઘની રામ શર્મા
2.	મનિષા કુમારી	0073394	397036	24242116-24242215	100	ઘની રામ શર્મા

તારીખ ૬ નવેમ્બર, ૨૦૧૮ ના સેબીના પરિપત્રમાં જણાવેલ કલમ ૨(સી) મુજબ જો ટ્રાન્સફરની સહીમાં ભોટી વિસંગતતા હોય / ઉપલબ્ધ ન હોય તેવી બાબતમાં જરૂરી કાર્યવાહીની પૂર્તિ કરીને શેરોના ટ્રાન્સફરની મંજૂરી આપી ટ્રાન્સફર કરી શકાશે. જો કંપની / તેના શેર ટ્રાન્સફર એજન્ટને (એટલે કે એ. સિંઘ ઈન્ટરપ્રાઇઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સી-૧૦૧, ૨૧૪ પાર્ક, એલ.બી.એસ. માર્ગ, વિજોલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૩) આ નોટીસ પ્રસિદ્ધ થયાના દિન-૩૦ માં કોઈપણ વાંધો નહીં મને તો કંપની દ્વારા ઉપરોક્ત જણાવેલ શેરોને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરશે.

ગુએચસીએલ લિમિટેડ વતી  
સહી/  
સુવલેખર મિશ્રા  
ચેરમેન  
તારીખ : ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૦  
સિનિયર જનરલ મેનેજર અને કંપની સેક્રેટરી

**નામ બદલેલ છે**

મારૂ નામ પટેલ સાહિલકુમાર દશરથભાઈથી પટેલ સાહિલકુમાર દશરથભાઈ કરેલ છે. ૧૨, મહાલક્ષ્મી સોસાયટી, બહારમઢ, ઊંઝા-૩૮૪૧૭૦

**નામ બદલેલ છે**

મારૂ જૂનું નામ શીરાવાલા એયૂબ નુરમોહમદથી બદલીને નવું નામ શીરાવાલા એયૂબ નુરમોહમદ કરેલ છે. એડ્રેસ: ૮૩૬, પાંચપીપળી, ઈકબાલ હોટેલની સામે, જમાલપુર, અમદાવાદ

**નામ બદલેલ છે**

મારૂ જૂનું નામ શીરાવાલા રેહમત એયૂબ નુરમોહમદથી બદલીને નવું નામ શીરાવાલા રેહમતબીબી એયૂબ કરેલ છે.

**પંજાબ નેશનલ બેંક** Punjab National Bank  
...પરોલે કા પ્રતીક ! ...the name you can BANK upon !

સરખ સર્કલ, અમદાવાદ

**APPENDIX IV (See Rule 8 (1)) કંબજા નોટીસ (સ્થાવર મિલકતો માટે)**

આથી, નીચે સહી કરનાર પંજાબ નેશનલ બેંક ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રીફાઇન્સિંગ ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્વોસ્ટમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ ની ધારા ૧૩(૧૨) સાથે વંચાતા નિયમ ૬, સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એન્વોસ્ટમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના અંતર્ગત લા. ૧૫.૦૨.૨૦૨૦ ના રોજ ફિનાન્સ નોટીસ જારી કરેલ હતી જેમાં જણાવેલ ધારા ૧૩(૧૨) હેઠળ કરજદારો / જામીનદાર / ગેરિસર્તા મેસર્સ હોલ્સ રોયલ ફિલ્મ ને નોટીસમાં જણાવેલ રકમ રૂ. ૨૭,૨૭,૧૦૭.૬૬ (રૂપિયા સત્તાવીસ લાખ સત્તાવીસ હજાર એકસો સાત અને પૈસા નવ્વાણું માત્ર) નોટીસ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસોમાં ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

કરજદાર આ રકમ ચુકવવામાં અસક્ષમ રહેલ છે, આથી કરજદારો અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એન્વોસ્ટમેન્ટ) નિયમો, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૮ ના ધારા ૧૩(૧) લા. ૧૮-૦૮-૨૦૨૦ ના અંતર્ગત નીચે દર્શાવેલ કરેલ અધિકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ મિલકતનો કબજો મેળવેલ છે.

કરજદારને વિશેષરૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકતો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલકતો અંગે કોઈપણ વ્યવહાર પંજાબ નેશનલ બેંક (એચઆરએમબી)ની બાકી રકમ રૂ. ૨૭,૨૭,૧૦૭.૬૬ (રૂપિયા સત્તાવીસ લાખ સત્તાવીસ હજાર એકસો સાત અને પૈસા નવ્વાણું માત્ર) તા. ૩૧.૦૧.૨૦૨૦ સુધીના વ્યવસ્થાપક વ્યાજ સાથેના બોજાને આધિન રહેશે.

નીચેના યમલે અસક્ષમતાથી આપેલા સમયમાં હોડાવવા અંગે દેવાદારનું સરકારી કાયદા સેશન ૧૩ ના સબ-સેશન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

**નીચે મિલકતોનું વર્ણન**

બ્લોક નં. "ડી", દુકાન/ઓફીસ નં. ૪૦૧ થી ૪૧૪ અને ૪૩૪ અને ૪૩૫, ચોવી માળ, શુભન એવન્યુ, ક્ષેત્રફળ અંદાજે ૬૬૭૨ ચો.ફુટ એટલે કે ક્ષેત્રફળ અંદાજે ૮૭૦.૭૭ ચો.ચાર્ડ એટલે કે ૭૨૮ ચો.મી. તેની સાથે અવિભાજ્ય ભાગની જમીન ક્ષેત્રફળ અંદાજે ૧૧૬૫ ચો.ફુટ, રેવન્યુ સર્વે નં. ૧૦૦૮.૮ી.પી. સ્કીમ નં. ૫, શાઈવલ પ્લોટ નં. ૧૯૧, ક્ષેત્રફળ ૪૦૩૧ ચો.મી., મોજી / માગ / કલોલ, તાલુકો કલોલ, રજીસ્ટ્રેશન સબ જીલ્લો : કલોલ, જીલ્લો ગાંધીનગર, ગુજરાતમાં આવેલી અચલિત મિલકતોના સમગ્ર અંગેની વિગતો માટે અધિકારીને સંપર્ક કરવો જોઈશે.